

**B.Com. Semester - 2 (CBCS) Examination**  
**June/July -2022 [NEW COURSE]**  
**Accounting-2 (ELECTIVE)**

**Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 શ્રી બળદેવભાઈ પાસે બે ખેતર A અને B છે. બન્ને ખેતર વિશેની માહિતી તા.31-12-2021ની માહિતી નીચે (20) મુજબ છે.

| શરૂ સ્ટોક           | A     | B      |
|---------------------|-------|--------|
| બિયારણ              | 3000  | 4400   |
| ખાતર                | 47000 | 64600  |
| બિયારણની ખરીદી      | 84000 | 102000 |
| ખાતરની ખરીદી        | 3000  | 5000   |
| જંતુનાશક દવાનો ખર્ચ | 6000  | 5000   |

વધારાની માહિતી:-

|                                                                 |         |
|-----------------------------------------------------------------|---------|
| દૂધનું વેચાણ                                                    | 100000  |
| ઘાસનું વેચાણ                                                    | 35200   |
| અનાજનું વેચાણ-A ખેતર                                            | 480000  |
| અનાજનું વેચાણ-B ખેતર                                            | 720000  |
| કાયમી મજૂરોને વેતન                                              | 120000  |
| હંગામી મજૂરોને વેતન                                             | 80000   |
| સિંચાઈના ખર્ચા                                                  | 24000   |
| મૂડી                                                            | 1441200 |
| પાકનું વીમા પ્રીમિયમ                                            | 3200    |
| ઢોર ઢાંખરનું વીમા પ્રીમિયમ                                      | 1400    |
| ટ્રેક્ટરના ખર્ચા                                                | 64000   |
| ઢોર ઢાંખરના ખર્ચા                                               | 26000   |
| ટ્રેક્ટર                                                        | 840000  |
| ખેતર                                                            | 1200000 |
| સાધનો                                                           | 440000  |
| સહકારી મંડળીની લોન                                              | 600000  |
| ઢોર ઢાંખર (તા.1-1-2021)                                         | 160000  |
| અંગત વપરાશ માટે લિધેલ અનાજ (ખેતર A અને B માટે 4:3 ના પ્રમાણમાં) | 28000   |
| ખેતર A જમીન મહેસૂલ                                              | 3000    |
| ખેતર B જમીન મહેસૂલ                                              | 4800    |
| પાક વેચાણ અંગે મંડળી પાસે લેણા                                  | 36000   |
| બેંક સિલક                                                       | 53000   |
| રોકડ સિલક                                                       | 25000   |

વધારાની માહિતી:-

- (1) આખર સ્ટોક: ખાતર રૂ.30000, બિયારણ રૂ.2400, અનાજ 80000 રૂ.
  - (2) આખર સ્ટોક વેતન અને સિંચાઈ ખર્ચા ખેતર A અને B વચ્ચે તેના વિસ્તારના પ્રમાણમાં ફાળવવાના છે. ખેતર A 2 એકર અને B 3 એકર છે.
  - (3) વર્ષ દરમિયાન બન્ને ખેતરમાં શાકભાજી ઉગાડવામાં આવેલ છે. ખેતર Aના રૂ.33000ની કિંમતના અને ખેતર Bના રૂ.44000ની કિંમતના શાકભાજી વેચ્યા જેની નોંધ ચોપડામાં કરેલ નથી તે શામજીભાઈને વેચ્યા અને તેમના તરફથી કોઈ કિંમત ચૂકવવામાં આવી નથી.
  - (4) ટ્રેક્ટર અને સાધનો પર 20% લેખે ધસારો ગણવો.
  - (5) તા.31-12-21ના રોજ ઢોર ઢાંખરની કિંમત રૂ.124000 ગણવી.
  - (6) સહકારી મંડળીની લોન પર 10% લેખે 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે.
- ઉપરની માહિતી પરથી કૃષિ નફા નુકશાન ખાતું અને સામાન્ય નફા નુકશાન ખાતું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-1 જયદેવભાઈ બે એકર ખેતીની જમીન ધરાવે છે, તારીખ 31-3-21 નાં પૂરા થતા વર્ષની માહિતી પરથી કૃષિ ખાતું તૈયાર કરો.

|      |                                                                                                                                                                                                                                   |          |   |        |          |       |
|------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------|---|--------|----------|-------|
| (1)  | શરૂ સ્ટોક                                                                                                                                                                                                                         | બિયારણ   | - | 2500,  | ખાતર     | 5500  |
|      |                                                                                                                                                                                                                                   | દવાઓ     | - | 4000,  | ઢોરઢાંખર | 23000 |
| (2)  | ખરીદી                                                                                                                                                                                                                             | ખાતર     | - | 12500, | બિયારણ   | 7500  |
|      |                                                                                                                                                                                                                                   | ડિઝલ     | - | 25000, | દવાઓ     | 8000  |
| (3)  | આખર સ્ટોક                                                                                                                                                                                                                         | બિયારણ   | - | 2800,  |          |       |
|      |                                                                                                                                                                                                                                   | દવાઓ     | - | 3200,  |          |       |
|      |                                                                                                                                                                                                                                   | ઢોરઢાંખર | - | 20000, |          |       |
| (4)  | ઘઉંનું ઉત્પાદન 9000 kg. હતું જેની પડતર રૂ.8 હતી. આ ઉત્પાદનમાંથી 7500 kg. ઘઉં કિલોદીઠ 12 લેખે વેચ્યા હતા.<br>500 kg. ઘઉં ઘર વપરાશ માટે લિધા હતા.<br>250 kg. ઘઉં મજૂરોને મજૂરી પેટે આપેલા હતા.<br>100 kg. ઘઉં ધર્માદામાં આપેલા હતા. |          |   |        |          |       |
| (5)  | ચોખાનું ઉત્પાદન 7000 kg.નું હતું જેની પડતર રૂ.15 હતી. આ ઉત્પાદનમાંથી 6000 kg. ચોખા કિલો દિઠ 25 લેખે વેચ્યા હતા.<br>200 kg. ચોખા ઘર વપરાશ માટે લીધા હતા.<br>80 kg. ચોખા ચોરાઈ ગયા હતા.                                             |          |   |        |          |       |
| (6)  | બાજરીનું વેચાણ થતા રૂ.19500 ઉપજ્યા હતા.                                                                                                                                                                                           |          |   |        |          |       |
| (7)  | દૂધ 2500 લીટર, ઘી 100 કિ.ગ્રા. અનુક્રમે 15 રૂ. લિટર દીઠ અને રૂ.150 કિલો દીઠ વેચ્યું હતું.                                                                                                                                         |          |   |        |          |       |
| (8)  | વાડ કરવાનો ખર્ચ રૂ.75000 5 વર્ષમાં માંડી વાળવાનો છે.                                                                                                                                                                              |          |   |        |          |       |
| (9)  | 12%ની બેંક લોન 1-10-20ના રોજ 150000ની લીધી હતી.                                                                                                                                                                                   |          |   |        |          |       |
| (10) | અન્ય ખર્ચા:                                                                                                                                                                                                                       |          |   |        |          |       |
|      | કુલ મજૂરી (ચૂકવવાની બાકી રૂ.5000 સહિત)                                                                                                                                                                                            |          |   |        |          | 35000 |
|      | વીમા પ્રીમિયમ ઢોર માટે                                                                                                                                                                                                            |          |   |        |          | 5000  |
|      | વીમા પ્રીમિયમ પાક માટે                                                                                                                                                                                                            |          |   |        |          | 12000 |
|      | પાણી ખર્ચા                                                                                                                                                                                                                        |          |   |        |          | 17500 |

પ્રશ્ન-2 અમીત બ્રધર્સ ચાર્મી લિ. પાસેથી એક ખાણ 1-1-2017ના રોજ નીચેની શરતે ભાડાપટે લીધી. (20)

- (1) રોયલ્ટી દર ટને રૂ.3 લેખે ચૂકવવાની છે.
- (2) 2017ના વર્ષ માટે લઘુત્તમ ભાડું રૂ.40000 રહેશે. ત્યારબાદ દર વર્ષે 2000નો વધારો થશે.
- (3) અકસ્માત કે હળતાલના વર્ષ લ.ભાડું 25% ઘટશે. 2021ના વર્ષમાં અકસ્માતના કારણે ઉત્પાદન 3 માસ માટે બંધ રહ્યું હતું.
- (4) ઓછા કામનું નુકશાન જે વર્ષે થાય ત્યાર પછીના 2 વર્ષ સુધી પ્રથમ વર્ષે 50% અને બીજા વર્ષે 50% પ્રમાણે મજરે લેવાનો હક છે.
- (5) 2017 અને 2018ના વર્ષનું ઓછું કામ અનુક્રમે રૂ.5000 અને રૂ.15000 હતું.
- (6) ઉત્પાદન નીચે મુજબ હતું.

| વર્ષ         | 2019  | 2020  | 2021  | 2022  |
|--------------|-------|-------|-------|-------|
| ઉત્પાદન (ટન) | 18000 | 15000 | 12000 | 20000 |

રોયલ્ટી કોષ્ટક અને ખરીદનારના ચોપડે (1) રોયલ્ટી ખાતું (2) ઓછા કામનું નુકશાન (3) ખાણ માલિકનું ખાતું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-2 કૃપા લિ. તા.1-1-13ના રોજ પૃથ્વી લિ. પાસેથી 10 વર્ષના ભાડાપટે નીચેની શરતોએ ખાણ ભાડાપટે લીધી.

- (1) રોયલ્ટીનો દર ટન દીઠ રૂ.4.
- (2) લઘુત્તમ ભાડું પ્રથમ 4 વર્ષ માટે રૂ.25000 વાર્ષિક ત્યાર બાદ 4 વર્ષ માટે રૂ.28000 વાર્ષિક અને ત્યારબાદ રૂ.30000 વાર્ષિક.
- (3) ઓછા કામનું નુકશાન જે વર્ષે થયું હોય તે પછીના 2 વર્ષમાં મજરે લઈ શકાય.
- (4) અકસ્માત હડતાલના કિસ્સામાં જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતા ઓછી હોય તો તે વર્ષે લ.ભાડું 25% ઘટાડવું.
- (5) છેલ્લા 4 વર્ષનું ઉત્પાદન નીચે મુજબ હતું.

| વર્ષ         | 2019  | 2020      | 2021    | 2022 |
|--------------|-------|-----------|---------|------|
| ઉત્પાદન (ટન) | 10000 | 8000      | 5000    | 7500 |
|              |       | (અકસ્માત) | (હડતાલ) |      |

- (6) 2017 અને 2018ના વર્ષની ઓછા કામની બાકી અનુક્રમે 8000 રૂ. અને 6000 રૂ. હતી.
- રોયલ્ટી કોષ્ટક અને ખરીદનારના ચોપડે (1) રોયલ્ટી ખાતું (2) ઓછા કામનું નુકશાન (3) ખાણ માલિકનું ખાતું તૈયાર કરો.

પ્રશ્ન-3 મેસર્સ રૂપલ ગેસ કંપનીના પોતાના કારખાનાના અમુક ભાગને રૂ.800000ના ખર્ચે પુનઃ બાંધકામ કરવામાં (15)

આવ્યું. જૂના ભાગના કારખાનાની કિંમત રૂ.500000 હતી. જૂની માલસામગ્રીના વેચાણનાં રૂ.30000 ઉપજ્યા છે. અને 20000 રૂ.ની કિંમતની જૂની માલસામગ્રી નવા બાંધકામમાં ઉપયોગ કરવામાં આવેલો છે. જેનો ઉપર જણાવેલ રૂ.800000ના ખર્ચમાં સમાવેશ થયો છે. જૂનું કારખાનું બંધાયું હતું તે કરતા અત્યારે માલસામાન અને મજૂરી કિંમતના અનુક્રમે 25% અને 17.5% વધું છે. અત્યારે અને તે વખતે માલસામગ્રી અને મજૂરીનું પ્રમાણ 3:2નું હતું.

ઉપરની માહિતી પરથી જરૂરી આમનોંધ તથા મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની ફાળવણી કરો.

અથવા

પ્રશ્ન-૩ શીમા એન્ડ કંપની પોતાના કારખાનાનું પુનઃબાંધકામ અને પુનઃસજાવટ કરવાનું તા.1-4-2021ના રોજ નક્કી કર્યું. જૂના કારખાનાની પડતર કિંમત ફક્ત રૂ.750000 હતી. કુલ ખર્ચમાં માલસામાન 3/5 ભાગ અને બાકીનો મજૂરી ખર્ચ હતો. નવા બાંધકામનો ખર્ચ રૂ.1200000 અંદાજેલ હતો. જૂનું કારખાનું બંધાયું તે કરતા માલસામાનના ભાવમાં 8%નો વધારો થયો હતો. અને મજૂરીના દરમાં 7%નો વધારો થયો હતો. તા.30-9-21ના રોજ અડધું કામ પુરું થયું હતું. અને તેના પર ખર્ચાવેલ રકમ રૂ.6000000 હતી.

તા.1-10-21ના રોજ એકાએક રૂપિયાનું અવમૂલ્યન થતા માલસામાનના ભાવમાં બીજા 7%નો વધારો થયો હતો. અને મજૂરીએ આંદોલન કરતા મજૂરીના દરમાં 3%નો વધારો થયો. બાકીનું કામ તા.31-3-2022ના રોજ પુરું થયું.

ઉપરની માહિતી પરથી જરૂરી આમનોંધ અને ખર્ચની ફાળવણી કરો.

પ્રશ્ન-4 ભરત બ્રધર્સ રામ લિ. પાસેથી તા.1-1-2019ના રોજ એક યંત્ર હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા ખરીદે છે. યંત્રની રોકડ કિંમત 100000 રૂ. છે. કુલ ચૂકવણી નીચે મુજબ કરી. (15)

તા.1-1-2019 ના રોજ રૂ.20000.

તા.31-12-2019 ના રોજ રૂ.25000.

તા.31-12-2020 ના રોજ રૂ.25000.

તા.31-12-2021 ના રોજ રૂ.25000.

તા.31-12-2022 ના રોજ રૂ.25000.

ભરત બ્રધર્સ વાર્ષિક 10%ના દરે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. આ ઉપરથી શોધો.

(1) વ્યાજ ફાળવણીની ગણતરી.

(2) હપ્તા ફાળવણી અને ઘસારાનો ચાર્ટ.

(3) ખરીદનારના ચોપડામાં યંત્ર અને વેચનારનું ખાતું તૈયાર કરો.

અથવા

પ્રશ્ન-4 જામનગર મોટર્સ લિમિટેડે હપ્તા ખરીદ પદ્ધતિએ એક સ્કુટરનું એક ગ્રાહકને વેચાણ કર્યું (1-4-19ના રોજ) ડિલિવરી વખતે રૂ.8000 પ્રથમ હપ્તો વર્ષનાં અંતે 8320, બીજા વર્ષના અંતે 7680 રૂ., ત્રીજા વર્ષના અંતે રૂ.7040ના વ્યાજ સહિતના હપ્તા ચૂકવવાના હતા.

ખરીદનાર સ્કુટર પર વાર્ષિક 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. બન્ને પક્ષનું હિસાબી વર્ષ: 31-03 છે.

ઉપરની માહિતી પરથી જરૂરી ગણતરી, હપ્તા ફાળવણી અને ઘસારાનો ચાર્ટ તથા ખરીદનારના ચોપડે સ્કુટર ખાતું, વેચનારનું ખાતું તૈયાર કરો.

## ENGLISH VERSION

Que-1 Shri Baldevbhai has two fields A and B. the following information relating to two fields is available as on 31-12-2021. (20)

| Opening Stock          | A     | B      |
|------------------------|-------|--------|
| Seeds                  | 3000  | 4400   |
| Fertilizers            | 47000 | 64600  |
| Purchase of Seeds      | 84000 | 102000 |
| Purchase of fertilizer | 3000  | 5000   |
| Insecticide expenses   | 6000  | 5000   |

Additional Information:-

|                          |        |
|--------------------------|--------|
| Sales of milk            | 100000 |
| Sale of grass            | 35200  |
| Sales of grain (field A) | 480000 |

|                                                                        |         |
|------------------------------------------------------------------------|---------|
| Sales of grain (field B)                                               | 720000  |
| Wages to permanent workers                                             | 120000  |
| Wages to casual workers                                                | 80000   |
| Irrigation expenses                                                    | 24000   |
| Capital                                                                | 1441200 |
| Insurance premium for crop                                             | 3200    |
| Insurance for cattle                                                   | 1400    |
| Expenses of tractor                                                    | 64000   |
| Expenses of cattle                                                     | 26000   |
| Tractor                                                                | 840000  |
| Farms                                                                  | 1200000 |
| Implements and tools                                                   | 440000  |
| Loan from co-op credit society                                         | 600000  |
| Live stock on 1-1-2021                                                 | 160000  |
| Grain taken for personal use (in the ratio of 4:3 for both the fields) | 28000   |
| Land revenue field A                                                   | 3000    |
| Land revenue field B                                                   | 4800    |
| Amount due form co-operative society for grains sold                   | 36000   |
| Deposit with bank                                                      | 53000   |
| Cash on hand                                                           | 25000   |

Additional information:

- (1) Closing stock was Rs.3000 for fertilizers, Rs.2400 for seeds and Rs.80000 for grains.
  - (2) Closing stock of wages and irrigation expenses are to be apportioned between fields A and B in the ratio of their areas. The area of fields A and B is 2 acres and 3 acres respectively.
  - (3) During the year, vegetables were grown on both the fields. Vegetables of field A of Rs.33000 and field B of Rs.44000 were sold to Shamjibhai which is not recorded in the books of accounts no amount of this sale is received form Rs. Shamjibhai.
  - (4) Provide depreciation on tractor and implements and tools at 20% P.A.
  - (5) Live stock was valued at Rs.124000 on 31-12-2021.
  - (6) 6 months interest on 10% loan from Co-operative society is unpaid.
- Prepare Farm profit and Loss A/c and General Profit and loss A/c.

OR

Que-1 Jaydevbhai possesses two acre land for agriculture. Prepare farm account form the particulars given below for the year ending 31<sup>st</sup> march 2021.

|                           |            |       |
|---------------------------|------------|-------|
| <b>(1) Opening Stock:</b> | Seeds      | 2500  |
|                           | Fertilizer | 5500  |
|                           | Pesticides | 4000  |
|                           | Live stock | 23000 |
| <b>(2) Purchase:</b>      | Fertilizer | 12500 |
|                           | Seeds      | 7500  |
|                           | Diesels    | 25000 |
|                           | Pesticides | 8000  |
| <b>(3) Closing Stock:</b> | Seeds      | 2800  |
|                           | Pesticides | 3200  |
|                           | Live stock | 20000 |

- (4) Production of wheat was 9000 kg. whose cost to be considered at Rs.8 per kg. out of this production.  
 7500 kg. wheat were sold at Rs.12 per kg.  
 500 kg. wheat were taken for personal use.  
 250 kg. wheat were given to worker in lieu of wages.  
 100 kg. wheat were given to charity.
- (5) Production of Rice was 7000 kg. whose cost to be considered at Rs.15 per kg. out of this production.  
 6000 kg. rice were sold out at Rs.25 per kg.  
 200 kg. rice were taken for personal use.  
 80 kg. rice were stolen away.
- (6) Production of millet was sold out for Rs.19500.
- (7) Milk 2500 lt. and Ghee 100 kg. sold out at Rs.15 per lt. and Rs.150 per kg. respectively.
- (8) The cost of fence was Rs.75000. it will be abolished within 5 years.
- (9) 12% Bank loan taken on 1-10-2020 for Rs.150000.

**(10) Other Expenses:**

|                                                                  |       |
|------------------------------------------------------------------|-------|
| Total wage (Including outstanding Rs.5000)                       | 35000 |
| Insurance premium (For live stock)                               | 5000  |
| Insurance premium (for crop)                                     | 12000 |
| Water charges Rs.17500, Land revenue Rs.3500, Ele. Bill Rs.22000 |       |

Que-2 Amit brothers hired a mine, from Charmy ltd. on 1-1-2017 with the following condition. (20)

- (1) Rate of Royalty is Rs.3 per ton.  
 (2) Minimum Rent for the year 2017 is Rs.40000 than after it is increase Rs.2000 every year.  
 (3) In the year of Accident and Strike, minimum rent is reduced by 25%. In the year 2021 due to accident, production is stopped for 3 months.  
 (4) The short working of any year is recoverable during the next 2 year in first year 50% and second year 50%.  
 (5) In the year 2017 and 2018, the balance of short working is Rs.5000 and Rs.15000.  
 (6) The production is mention as under.

| Year             | 2019  | 2020  | 2021  | 2022  |
|------------------|-------|-------|-------|-------|
| Production (Ton) | 18000 | 15000 | 12000 | 20000 |

Prepare Royalty table and following account in the books of purchaser

- (1) Royalty A/c. (2) Short Working (3) Lessor A/c.

OR

Que-2 Krupa ltd. hired a mine, from Pruthvi ltd. on 1-1-2013 for 10 years with the following condition.

- (1) Rate of Royalty is Rs.4 per ton.  
 (2) Minimum rent for the first 4 years Rs.25000 each year, than after 4 years Rs.28000 each year and for the remaining years 30000 yearly.  
 (3) The short working of any year is recoverable during the next 2 years.  
 (4) If due to Accident and Strike, royalty is less than the minimum rent, than minimum rent is reduced by 25%  
 (5) The production is mention as under.

| Year             | 2019  | 2020               | 2021             | 2022 |
|------------------|-------|--------------------|------------------|------|
| Production (Ton) | 10000 | 8000<br>(Accident) | 5000<br>(Strike) | 7500 |

- (6) In the year 2017 and 2018, the balance of short working is Rs.8000 and Rs.6000.  
 Prepare Royalty table and following account in the books of purchaser  
 (1) Royalty A/c. (2) Short Working (3) Lessor A/c.

- Que-3 M/s Rupal gas company re-built part of its works at a cost of Rs.800000. the cost the works superseded is Rs.500000. Sale of old material realized Rs.30000 and old materials valuing Rs.20000 are used in the new construction and it is included in above mentioned cost Rs.800000. The cost of material and labour is respectively 25% and 17.5% higher now than when the old works were built. The proportion of material and labour in works now and then is 3:2. (15)

Draft necessary journal entries and show the allocation of capital expenditure and revenue expenditure.

OR

- Que-3 Shima & co. decided to re-build and re-equip his factory on 1-4-2021. The old factory had cost only Rs.750000. of these material cost constitutes  $\frac{3}{5}$  of the total expenditure and labour accounted for the rest. The expenditure of new construction was estimated at Rs.1200000. Prices of materials have increased by 8% and wage rate have gone up by 7% since the old factory was built. Half of the work was completed on 30-9-2021. And the expenditure incurred on it was Rs.6000000.

On 1-10-2021 all of sudden due to devaluation of a rupee, prices of materials have further gone up by 7% and due to labor movement wage rates have increased by 3%. Therefore replacement cost has increased proportionately. The remaining work was completed as on 31-3-2022.

Give journal entries to record above transactions, and also show your calculations of allocations of capital and revenue expenditure.

- Que-4 Bharat Brothers purchased a machine on dated 1-1-2019 on installment system from Ram ltd. the cash price of this machine was Rs.100000. Which was payable as under. (15)

|               |          |
|---------------|----------|
| On 1-1-2019   | Rs.20000 |
| On 31-12-2019 | Rs.25000 |
| On 31-12-2020 | Rs.25000 |
| On 31-12-2021 | Rs.25000 |
| On 31-12-2022 | Rs.25000 |

Buyer provides depreciation @ 10% on machine as per strait line method

From the given data, calculate the following.

- (1) Calculation of distribution of interest.
- (2) Distribution chart of installment and depreciation chart.
- (3) Machine A/c and Vendor's A/c in the books of Purchaser.

OR

- Que-4 Jamnagar motors ltd. sold a Scooter on dated 1-4-2019 on installment system to one customer.

At the time of delivery Rs.8000 was paid by the customer. First installment in first year end was Rs.8320, Second installment in Second year end was Rs.7680, Third installment in third year end was Rs.7040.

Buyer provides depreciation @ 10% on machine as per strait line method. Accounting year was ended on 31-03 every year.

Form the given data calculate the following.

- (1) Distribution chart of installment and depreciation chart.
- (2) Scooter A/c and Vendor's A/c in the books of Purchaser.

\*\*\*\*\*